

એપ્રિલ 4, 2018

## સીટી ઓફ બ્રામ્પટનને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં (પ્રસંગ ઉદ્યોગમાં) ઉત્કૃષ્ટતા માટે ઓળખ મળી પાંચ બ્રામ્પટન તહેવારો અને પ્રસંગોએ ઓન્ટેરિયોના ટોચના 100 માં નામાંકન મેળવ્યું

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટનને તાજેતરમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આગેવાન તરીકે ઓળખ મળી કારણ કે તેના પાંચ જટલા તહેવારો અને પ્રસંગોનું ઓન્ટેરિયોના ટોચના 100 માં નામાંકન કરવામાં આવ્યું હતું.

ફેસ્ટિવલ્સ એન્ડ ઈવેન્ટ્સ ઓન્ટેરિયો (FEO) દ્વારા તેની વાર્ષિક ટોચની 100 ની યાદીની ઘોષણા કરવામાં આવી, અને વર્ષ 2018 માટે ખ્યાતિ મેળવનારાઓમાં નીચેના બ્રામ્પટન તહેવારો અને પ્રસંગોનો સમાવેશ થયો હતો:

- સેલી-બ્રામ્પટન (CeleBrampton): શનિવાર, જૂન 9, 2018
- બ્રામ્પટન કેનેડા દિવસ ઉજવે છે: રવિવાર, જુલાઈ 1, 2018
- રિમેમ્બરન્સ ડે (સ્મૃતિ દિવસ) પરેડ અને સર્વિસ: રવિવાર, નવેમ્બર 11, 2018
- ક્રિસમસ ટ્રી લાઈટીંગ: શુક્રવાર, નવેમ્બર 16, 2018
- બ્રામ્પટન ન્યૂ ઈયર્સ ઈવ: સોમવાર, ડિસેમ્બર 31, 2018

બ્રામ્પટનના તમામ તહેવારો અને પ્રસંગોને લગતી વધુ માહિતી વેબસાઈટ પર જોઈ શકાય છે, [www.brampton.ca/events](http://www.brampton.ca/events).

સમગ્ર શહેરમાં જોવા અને કરવા લાયક તમામ રોમાંચક બાબતોની સંપૂર્ણ યાદી માટે, [ઔપચારિક બ્રામ્પટન મુલાકાતી માર્ગદર્શિકા 2018 ઓનલાઈન અહીં](#) તપાસો.

### અવતરણો (ક્વોટ્સ):

“અમે ફેસ્ટિવલ્સ એન્ડ ઈવેન્ટ્સ ઓન્ટેરિયો દ્વારા આપણાં શહેરની ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતા માટે ઓળખ મળવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. જુવાન અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કંપાયમાન, બ્રામ્પટનમાં તમામ લોકો માટે સમગ્ર વર્ષ દરમિયાન આનંદ માણવા પ્રસંગો અને તહેવારોની વ્યાપક શ્રેણી સામેલ છે. બ્રામ્પટનમાં હંમેશા કંઈક રોમાંચક કરવા લાયક હોય છે.”

- મેયર લિન્ડા જેફરી (Linda Jeffery)

“આપણાં સમુદાયોને સાથે લાવવાનું મહત્વ સમજવાથી આપણને દર વર્ષે ટોચના ગુણવત્તાસભર પ્રસંગો યોજવાની પ્રેરણા મળે છે. તહેવારો અને પ્રસંગો આપણાં શહેરની ન કેવળ કંપાયમાનતા વધારે છે, તેનાથી રહેવાસીઓ, ધંધાઓ, રોકાણ અને પર્યટનને આકર્ષાને અર્થતંત્રને વૃદ્ધિ પામવામાં મદદ મળે છે.”

- બોબ ડાર્લિંગ (Bob Darling), ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)